



મે 21 નાં વાવાઝોડા પછી સફાઈ કામગીરી પર અદ્યતન માહિતી

સીટી ઓફ બ્રેમ્પટનમાં વૃક્ષો હટાવવા, બદલવા અને યાર્ડમાંથી કચરો એકઠો કરવા વિશે જાણવાલાયક માહિતી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 25, 2022) – મે 21 નાં રોજ આવેલા વાવાઝોડા પછી શહેરભરમાં સફાઈ કામગીરી અને પુનઃસ્થાપન પ્રયત્નો ચાલુ છે.

કર્મચારીઓ હાલમાં સીટીની માલિકીના નુકસાન પામેલા વૃક્ષોવાળા સ્થળોના વિસ્તારને સુરક્ષિત બનાવવા કાર્યરત છે.

તાત્કાલિક જોખમો પર ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાને લીધે આગામી કેટલાક અઠવાડિયાઓથી વૃક્ષોના કચરાનો બુલેવાર્ડ્સ અને ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓમાં ભરાવો થયો હોઈ શકે.

પડી ગયેલા કે નુકસાન પામેલા વૃક્ષોની જાણ કરવી

સીટીની માલિકીના વૃક્ષો

સીટી ઓફ બ્રેમ્પટન ઉદ્યાનો અને ઘરની સામેના બુલેવાર્ડ્સ જેવી સીટીની માલિકીની મિલકતો પર સ્થિત વૃક્ષોની કાપકૂપ કે વૃક્ષો હટાવવા સહિતની, વૃક્ષોની નિભાવ-જાળવણીની કામગીરી કરે છે.

રહેવાસીઓ સીટીની માલિકીના કોઈપણ વૃક્ષોને હટાવવા કે તેને નુકસાન પહોંચાડવા અધિકૃત નથી.

વૃક્ષો હટાવવા માટેની વિનંતીઓનું પહેલા નિરીક્ષણ કરવામાં આવે છે:

- શરૂઆતમાં વિનંતી મળવાના લગભગ 90 દિવસ પછી નિરીક્ષણ કરવામાં આવે છે
- ફોરેસ્ટ્રી સ્ટાફ (વનવિભાગના કર્મચારીઓ) નિરીક્ષણ પૂરું થયું હોવાની જાણ કરવા ટ્રી ડોર હેંગર મૂકશે
- નિરીક્ષણ પછી જરૂરી કામનું સમયપત્રક નક્કી કરવામાં આવશે.

પરવાનગી વગર વૃક્ષ કાઢી નાખવાના કે વૃક્ષને નુકસાન પહોંચાડવાના અહેવાલોની તપાસ પાર્કર્સ એન્ડ ફોરેસ્ટ્રી અને બાય-લો એન્ડ્રોસમેન્ટ ડિપાર્ટમેન્ટ્સ કરે છે.

સીટીના કોઈ વૃક્ષની પડી ગયેલી ડાળીઓની, વૃક્ષો કે કચરાની જાણ કરવા, કૃપા કરી તમારો રિપોર્ટ ઓનલાઇન વેબસાઇટ www.311brampton.ca પર, અથવા 311 મોબાઇલ એપ અથવા 311 નંબર પર કોલ કરીને જણાવો.

ખાનગી વૃક્ષો હટાવવા

મિલકતના માલિક તરીકે તમે તમારી મિલકત પર ખાનગી માલિકીના વૃક્ષો કાઢી નાખી શકો છો, પરંતુ તેમાં વૃક્ષ [સાયવણી પેટા-કાનૂન](#) (ટ્રી પ્રિઝર્વેશન બાય-લો) પ્રમાણે પરવાનગી લેવાની જરૂર પડી શકે.

પરવાનગી લેવાની જરૂર ના પડે તેવા કેટલાક ઉદાહરણોમાં સામેલ છે:



- જો કોઈ વૃક્ષ કોઈ કબજાવાળી ઈમારતના બે મીટરની અંદર સ્થિત હોય
- જમીનથી 1.37 મીટરથી માપતા, 30 સેન્ટીમીટર્સથી ઓછાં વ્યાસવાળા વૃક્ષો
- જો કટોકટીમાં કોઈ કામ માટે વૃક્ષને નુકસાન પહોંચાડવું અનિવાર્ય બને.

સીટીની માલિકીના નવા/બદલવાના વૃક્ષોની વિનંતી કરવી

સીટી ઓફ બ્રેમ્પટન ઉદ્યાનો અને ઘરની સામેના બુલેવાર્ડ્સ જેવી સીટીની માલિકીની મિલકતો પર સ્થિત વૃક્ષો બદલવા સહિતની, વૃક્ષોની નિભાવ-જાળવણીની કામગીરી કરે છે.

જાહેર જનતાને સીટીની માલિકીના વૃક્ષો પર કાપકૂપ સહિત, કોઈ કામ કરવાની પરવાનગી નથી.

રહેવાસીઓ વૃક્ષો સંબંધિત વિનંતી કરે ત્યારે, નીચેના પગલાઓ હાથ ધરવામાં આવે છે:

- વૃક્ષનું નિરીક્ષણ શરૂઆતમાં વિનંતી મળવાના લગભગ 90 દિવસ પછી કરવામાં આવશે.
- ઈન્સ્પેક્ટર (નિરીક્ષક) તમારા દરવાજા પર 'ટ્રી ડોર હેંગર' મૂકીને તમને નિરીક્ષણ પૂરું થયું હોવાની જાણ કરશે.
- જરૂરી કામગીરી પૂરી કરવાનું સમયપત્રક બનાવવામાં આવશે.
- ફોરેસ્ટ્રી સ્ટાફ (વનવિભાગના કર્મચારીઓ) ભાવિ વૃક્ષારોપણનું અંદાજિત સ્થળ સૂચવવા કર્બ (ફૂટપાથ અને રસ્તા વચ્ચેની કિનારી) પર પેઇન્ટ કરેલી નિશાની મૂકી શકે.
- નવી રોપણી વિનંતીઓ આગામી કેલેન્ડર વર્ષમાં નિર્ધારિત કરવામાં આવે છે અને તે હવામાનને આધારિત, જૂન-ડિસેમ્બર વચ્ચે થાય છે.
- પ્રમાણિત આર્બોરિસ્ટ્સ (નુકસાન પામેલા વૃક્ષની માવજત કરવામાં નિષ્ણાત) જે તે વિસ્તાર માટે શ્રેષ્ઠ અનુકૂળ વૃક્ષોની પસંદગી કરે છે.

નવા/તબદીલ કરવાના વૃક્ષની વિનંતી, કૃપા કરી ઓનલાઇન www.311brampton.ca પર, 311 મોબાઇલ એપ પર અથવા 311 નંબર પર કોલ કરીને કરો.

રીજીયન ઓફ પીલ દ્વારા યાર્ડમાંથી કચરો ઉઠાવવો

રેસિડેન્શિયલ યાર્ડમાંથી વૃક્ષની કાપકૂપ અને ડાળીઓ સહિત, કચરો ઉઠાવવાની કામગીરી રીજીયન ઓફ પીલની આગેવાનીમાં કરવામાં આવે છે.

યાર્ડમાંથી કચરાનો નિકાલ કરતી વખતે, કૃપા કરી નીચેના નિયમો ધ્યાનમાં લેશો:

- યાર્ડમાંથી કચરો ઉઠાવવાના પાત્રો લેબલ ચોંટાડેલા, ખુલ્લાં, સખત, અને ફરીથી વાપરી શકાય તેવા હોવા રહ્યાં. જો તમે કાર્ટ કલેક્શન મેળવો તો, તમે તમારા યાર્ડના કચરા માટે જૂના ભૂરા કે રાખોડી ખોખાનો ઉપયોગ કરી શકો છો.
- બ્રશને બંડલમાં 1.2 મી (4 ફૂટ) જેટલી લંબાઈ અને 76 સે.મી. (30 ઈંચ) જેટલી પહોળાઈમાં ચુસ્તપણે બાંધો. બ્રશના બંડલોનું વજન 20 કિ.ગ્રા. (44 પાઉન્ડ)થી વધારે હોઈ શકે નહીં. કર્બ પરથી એકઠા કરવાના બ્રશ અને વૃક્ષની કાપકૂપનો વ્યાસ 10 સે.મી. (4 ઈંચ)થી ઓછો હોવો રહ્યો.
- યાર્ડનો કચરો સામેલ હોય તેવી માત્ર બ્રાઉન ક્રાફ્ટ પેપર બેગ્સ એકઠી કરવામાં આવે છે. પ્લાસ્ટિક બેગ્સ સ્વીકારવામાં આવતી નથી.
- એકત્રિત કરવાની યાર્ડનો કચરો ભરેલી બેગ કે કન્ટેઇનરનું વજન 20 કિ.ગ્રા. (44 પાઉન્ડ)થી ઓછું હોવું રહ્યું.
- તમારો યાર્ડનો કચરો અને તમારા કચરાના કાર્ટ વચ્ચે ઓછામાં ઓછી 1 મી. (3 ફૂટ) જેટલી ચોખ્ખી જગ્યા છોડી દો.



આ માર્ગરેખાઓને બંધબેસતો ન હોય તેવો રેસિડેન્શિયલ યાર્ડનો કચરો ફી લઈને, આખું વર્ષ, બધાં [પીલ કમ્યુનિટી રિસાઈકલિંગ સેન્ટર્સ \(CRCs\)](#) પર સ્વીકારવામાં આવે છે.

કચરો એકઠો કરવા અંગે વધુ માહિતી મેળવવા, રીજયન ઓફ પીલની [વેબસાઈટ અહીં](#) જુઓ.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)
સીટી ઓફ બ્રમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા
multiculturalmedia@brampton.ca